



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની સુચના

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને ૨

(જા. ક. ૦૯/૨૦૧૪-૧૫)

આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક:-૦૯/ ૨૦૧૪-૧૫, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને ૨ની મુખ્ય પરીક્ષામાં વૈકલ્પિક વિષય અંગ્રેજી સાહિત્યના પ્રશ્નપત્ર બાબતે કુલ-૧૬ ઉમેદવારો દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ સીએ નં. 5604/ 2017 ઇન એસસીએ નં. 8153/ 2017 તથા એસસીએ નં 9837/2017 અને એસસીએ નં. 9995/2017 માં નામદાર હાઇકોર્ટ દ્વારા વચગાળાની રાહત તરીકે પીટીશનરોનો રૂબરૂ મુલાકાતમાં શરતી સમાવેશ કરવા આદેશ કરવામાં આવેલ છે. નામદાર ગુજરાત હાઇકોર્ટના વચગાળાના પ્રસ્તુત ચુકાદાઓ અનુસાર જ્યારે સંબંધિત પીટીશનના પીટીશનર્સને આપવામાં આવેલ વચગાળાની રાહત તથા એસસીએ નં. 9837/ 2017 ના ઓરલ ઓર્ડર અનુસાર એસસીએ નં. 8153/ 2017 ના જેવા પ્રકારની સમાન સ્થિતિ ધરાવતા ઉમેદવારો બાબતે પણ વિચારણા કરતાં તદ્દન આવા જ પ્રકારમાં સમાવિષ્ટ થતા ઉમેદવારોને પણ તદ્દન શરતી ધોરણે રૂબરૂ મુલાકાતમાં સમાવિષ્ટ કરવાના થાય છે અને રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થિત રહેવા માત્રથી પસંદગી માટેના હક દાવા ઉપસ્થિત કરી શકાશે નહિં. નામદાર હાઇકોર્ટના ઉક્ત આદેશ અનુસાર આયોગ દ્વારા તા:- ૦૨/ ૦૬/ ૧૭ના રોજ રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવેલ છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને ૨ની મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી વિષય વૈકલ્પિક વિષય તરીકે રાખનાર અને મુખ્ય પરીક્ષામાં હાજર રહેનાર 84 ઉમેદવારો પૈકી જે ઉમેદવારોનો અગાઉ રૂબરૂ મુલાકાતમાં સમાવેશ થયેલ નથી તેવા 81 ઉમેદવારોની રૂબરૂ મુલાકાત યોજવા આયોગે નિર્ણય કરેલ છે. આથી, આ ઉમેદવારોને તા:-૦૨/ ૦૬/ ૧૭ના રોજ જરૂરી શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરેને લગતાં જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે સવારે ૯:૦૦ કલાકે આયોગની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા જણાવવામાં આવે છે. આ હેતુ માટે યોજવામાં આવેલ રૂબરૂ મુલાકાત અંતર્ગતના ઉમેદવારો માટે નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર બંધ કવરમાં રાખવામાં આવશે અને ઉક્ત પીટીશનના આખરી ચુકાદાને આધિન તદ્દન શરતી પ્રવેશ આપવામાં આવે છે તથા નામદાર ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો બંધનકર્તા રહેશે. ઉક્ત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેના કોલ લેટર અલગ રીતે મોકલવામાં આવી રહેલ છે.

જાહેરાત ક્રમાંક: 09/2014-15 ના આખરી પરિણામ તારીખ ૩૧/૦૫/૨૦૧૭ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવેલ પરંતુ, સદરહુ આયોજનમાં ઉપરોક્ત વિગતે રીશીડ્યુલ કરવામાં આવેલ છે, જેથી હવે આ કામે શક્ય તેટલી ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.